

**જનસંપર્ક અધીકારી દ્વારા**  
**પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર**  
**ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩**  
**કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦**

તા..૧૧/૧૦/૨૦૧૫ રવિવાર

**અમદાવાદ શહેર પોલીસ સમાચાર**

**નશાબંધી ધારા હેઠળ ઝડપાયા :-**

**સમાચાર યાદી નં.૨૦૫૨/૧૫**

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૨ કેસ કરી અને ૨૭ વ્યક્તિઓને ઝડપી ૫૮ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો.

**તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-**

**સમાચાર યાદી નં.૨૦૫૩/૧૫**

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૧૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

**અપહરણ:-**

**સમાચાર યાદી નં.૨૦૫૪/૧૫**

**અમરાઈવાડી:** સીમાબહેન હીરસિંગ રાજપુત (ઉ.વ.૧૫)(રહે.શિવનગર સોસાયટી રબારી કોલોની અમરાઈવાડી) ને તા.૫/૧૦/૧૫ બપોરના ૧/૪૫ વાગ્યાના સુમારે ઘર નજીક રહેતો આરોપી અમિત ઉર્ફે લાલો દેવેન્દ્રભાઈ રાજપુત ઘર નજીકથી લલચાવી ફોલસાવી જારકર્મ કરવાના ઈરાદે ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ સીમાબહેનના પિતા હીરસિંગ રાજપુતએ તા.૧૦/૧૦/૧૫ નારોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી ઓ એમ દેસાઈ ચલાવે છે.

**ધરફોડ:-**

**સમાચાર યાદી નં.૨૦૫૫/૧૫**

**મણીનગર:** મહેન્દ્રભાઈ પારસમલ જૈન (રહે.ઓમ જય અંબે એપાર્ટમેન્ટ દેવાંગ સોસાયટી સામે વલ્લભવાડી મણીનગર) એ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૧૦/૧૫ બપોરનાં ૧૨/૩૦ થી ૪/૪૫ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાની જાળીનો નકુચો તોડી અજાણી વ્યક્તિ ધરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાના દાગીના કિંમત રૂપિયા ૩,૩૧,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એન એસ દેસાઈ ચલાવે છે.

**જીઆઈડીસી વટવા:** સુવ્રતભાઈ નિર્મલચંદ ચોક્સી (રહે.શ્યામલ રો હાઉસ વિભાગ-૩ આનંદનગર રોડ સેટેલાઈટ) એ તા.૧૦/૧૦/૧૫ નારોજ જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૮/૧૦/૧૫ સાંજના ૫/૦૦ થી તા.૧૦/૧૦/૧૫ સવારના ૮/૩૦ વાગ્યા દરમિયાન જીઆઈડીસી વટવા ફેઝ-૪ ખાતે આવેલ પોતાની બ્રિજસન્સ એન્જિનિયર્સ કંપનીનો દરવાજો તોડી અજાણી વ્યક્તિ કંપનીમાં પ્રવેશ કરી કટીંગ પાર્ટસ, ટુક એસેસ નંગ-૨, ટ્રોલી નાની-મોટી નંગ-૧૨, લોખંડની ચેઈન રોલર ગાર્ડ નંગ-૨૫, ટુક રોડ નંગ-૨૦, સ્કેપ અને પ્લેટ નંગ-૧ મળી કુલ કિંમત રૂપિયા ૧,૧૩,૬૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ એન કરંગીયા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૦૫૬/૧૫

**માધવપુરા:** અમીતભાઈ ટેકચંદ ગંગવાની (રહે.સીન્ધી કોલોની આંબાવાડી સરદારનગર) તા.૧૦/૧૦/૧૫ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે માધવપુરા રામદેવ મસાલાની બાજુમાં પોતાનું મોટર સાયકલ પાર્ક કરી નોકરને સાચવવાનું કહી દુકાનમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે અજાણી વ્યક્તિએ અમીતભાઈના નોકરને આવીને કહ્યું હતું કે તમારા પૈસા પડી ગયા છે તેમ કહેતા નોકર રૂપિયા ૧૦-૧૦ ની નોટ લેવા જતા નજર ચુકવી અજાણી વ્યક્તિ મોટર સાયકલની હુકમાં ભરાવેલ બેગની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી. જે બેગમાં રોકડ રૂપિયા ૬,૪૦,૩૬૦/- મતા હતી. આ અંગેની ફરીયાદ અમીતભાઈ ગંગવાણીએ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે એ ચૌધરી ચલાવે છે.

સોનાનો દોરો ખેંચી તોડી લઈ ગયો:-

સમાચાર યાદી નં.૨૦૫૭/૧૫

**કાગડાપીઠ:** ચંદ્રીકાબહેન પ્રકુલભાઈ ગોહીલ (ઉ.વ.૩૩)(રહે.ચંદ્રવિહાર એપાર્ટમેન્ટ મંગલપાર્ક સોસાયટી સામે કાંકરીયા) તા.૨/૧૦/૧૫ રાતના ૮/૩૦ વાગ્યાના સુમારે મંગલપાર્ક સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલ (૨૫ થી ૩૦ વર્ષના આશરાનો) એક પુરુષ ચંદ્રીકાબહેનના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૩૭,૩૩૦/- ખેંચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ ચંદ્રીકાબહેન ગોહીલે તા.૧૦/૧૦/૧૫ નારોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી જી એમ મકવાણા ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૨૦૫૮/૧૫

**વટવા:** મીનાબહેન ગેલાભાઈ ઝાપડીયા (રહે. હરજીભાઈની ચાલી ભરવાડવાસ રાણીપુર રોડ ખોડીયાર હોટલની પાછળ શાહવાડી) એ તા.૧૦/૧૦/૧૫ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૯/૧૦/૧૫ સાંજના ૭/૩૦ વાગ્યાના સુમારે લાભાથી નારોલ જતા બ્રીજ ઉતરતા રોડ ઉપરથી મીનાબહેનના માતા જવજીબહેન (ઉ.વ.૬૦) પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે રીક્ષા પુરઝડપે અને બેદરકારીથી ચલાવી જવજીબહેનને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે એસ પટેલ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.